

- અખબારી યાદી:-

## રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે સફેદવાઘણે ૦૨(બે)

### વાઘ બાળને જન્મ આપ્યો

મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, મ્યુનિ. કમિશનરશ્રી તેમજ બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેનશ્રીએ સંયુક્ત યાદીમાં જણાવેલ

તારીખ: ૨૧-૦૫-૨૦૨૨

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ૧૦૮ દિવસના ગર્ભાવસ્થાના અંતે તા.૧૮/૦૫/૨૦૨૨ના રોજ વહેલી સવારના સમયે વાઘ બાળ જીવ-૦૨(બે)નો જન્મ થયેલ છે. માતા ગાયત્રી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાં ઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડલ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે તેમ મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા તેમજ બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેનશ્રી અનીતાબેન ગોસ્વામી દ્વારા સંયુક્ત માહિતી આપવામાં આવી હતી.

રાજકોટ ઝૂ ખાતે અગાઉ સફેદ વાઘમાં થયેલ બ્રીડિંગની વિગત :

- (૧) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.૦૬/૦૫/૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૦૧ માદાનો જન્મ થયેલ.
- (૨) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૬/૦૫/૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૦૪ માદાનો જન્મ થયેલ.
- (૩) નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૦૨/૦૪/૨૦૧૯ના રોજ સફેદ વાઘ બાળ ૦૪ (નર-૦૨ માદા-૦૨)નો જન્મવ થયેલ.

(૪) તાજેતરમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૮/૦૫/૨૦૨૨ના રોજ સફેદ વાઘ બાળ ૦૨ (બે) નરનો જન્મ થયેલ.

આમ રાજકોટ ઝૂ ખાતે અત્યાાર સુધીમાં કુલ ૧૧ (અગીયાર) સફેદ વાઘ બાળનો જન્મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે ૧૦ બચ્ચાંને જન્મ આપેલ તેમજ યશોધરા વાઘણે ૦૧ બચ્ચાંને જન્મ આપેલ.

રાજકોટ ઝૂ માં સફેદ વાઘનું આગમન :

વન્યોપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છત્તીસગઢ)ને સિંહની એક જોડી (સિંહ-નીલ તથા સિંહણ-સૌમ્યા) વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન આપવામાં આવેલ છે. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાઘ નર દિવાકર, સફેદ વાઘણ યશોધરા તથા સફેદ વાઘણ ગાયત્રી આપવામાં આવેલ.

રાજકોટ ઝૂ દ્વારા અન્યે ઝૂને આપેલ સફેદ વાઘની વિગત :

ક્રમ	ઝૂની વિગત	વર્ષ	સફેદ વાઘની સંખ્યા
૦૧	કાંકરીયા ઝૂ, અમદાવાદ	૨૦૧૭-૧૮	સફેદ વાઘ માદા-૦૧
૦૨	છતબીર ઝૂ, પંજાબ	૨૦૧૯-૨૦	સફેદ વાઘ માદા-૦૧
૦૩	રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પૂના	૨૦૨૦-૨૧	સફેદ વાઘ માદા-૦૧
૦૪	ઇન્દ્રોઘડા નેચર પાર્ક, ગાંધીનગર	૨૦૨૦-૨૧	સફેદ વાઘ નર-૦૧, માદા-૦૧
૦૫	ડો.શ્યા-માપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સુરત	૨૦૨૧-૨૨	સફેદ વાઘ નર-૦૧, માદા-૦૧

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગિક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઈ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ -૦૨નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા ૦૬ થઈ ગયેલ છે. જેમાં પુખ્ત નર-૦૧, પુખ્ત માદા-૦૩ તથા બચ્ચા-૦૨નો સમાવેશ થાય છે.

હાલ ઝૂ માં જુદી જુદી ૫૯ પ્રજાતિઓનાં કુલ-૪૯૦ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

(પી.એ.ટુ મેયર)